

AG-135

April-2015

B.Sc., Sem.-VI (CBCS Sem. System)**311 : Chemistry
(Nanomaterials and Nanotechnology)****Time : 3 Hours]****[Max. Marks : 70**

- સ્વીચ્છના :** (1) દરેક પ્રેશના સરખા માર્ક્સ છે.
 (2) જમણી બાજુએ રહેલ આંકડાઓ માર્ક્સ દર્શાવે છે.

1. (અ) સોલ-જેલ પદ્ધતિ પર આકૃતિ સાથે ટૂંકનોંધ લખો. 7
અથવા

કાર્બનિક આણુઓના ઉપયોગ દ્વારા નેનોકેષોની સ્વગોઠવણી (self-assembly) પર નોંધ લખો.

- (બ) સ્પ્ટર્ટરીંગ (Sputtering) એટલે શું ? આકૃતિ સાથે સ્પ્ટર ડીપોર્જિશન (Sputter deposition) પદ્ધતિ ચર્ચો. 7

અથવા

લેઝર બાષ્પીભવન (Laser Vaporization) પદ્ધતિ આકૃતિ સાથે વર્ણવો અને તેનો એક ઉપયોગ આપો.

2. (અ) પદો સમજાવો.
 (i) કવોન્ટમ ડોટ્સ અને
 (ii) કવોન્ટમ વેલ્સ

અથવા

કાર્બન નેનોટ્યુબ્ઝ (nanotubes)ના પ્રકારો પર નોંધ લખો.

- (બ) ફુલરીન્સ (Fullerenes) પર નોંધ લખો. 7

અથવા

“નેનોરોડ્રઝ” પદ સમજાવો અને મેટાલીક નેનોરોડ્રઝ પર નોંધ લખો.

3. (અ) આકૃતિ સાથે ટ્રાન્સમિશન ઈલેક્ટ્રોન માઇક્રોસ્કોપ (Transmission Electron Microscope) પર નોંધ લખો. 7

અથવા

આકૃતિ સાથે સ્કેનીંગ ઈલેક્ટ્રોન માઇક્રોસ્કોપ (Scanning Electron Microscope) પર નોંધ લખો.

- (બ) નેનોમટીરીયલ્સ માટે ક્ષ-કિરણ વિવર્તન (X-ray Diffraction) ટેકનીક આકૃતિ સાથે ચર્ચો. 7

અથવા

ઓગાર ઈલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી (Auger electron spectroscopy) આકૃતિ સાથે વર્ણવો.

4. (અ) સોલાર એનર્જીના ક્ષેત્રમાં નેનોટેકનોલોજીની ઉપયોગીતા પર નોંધ લખો. 7

અથવા

ઈલેક્ટ્રોનીક્સ ડિસ્પ્લે અને તેના જેવી અન્ય બીજી બનાવટોમાં નેનોટેકનોલોજીની ઉપયોગીતા વર્ણવો.

- (બ) નેનોમેડિસીન્સ અને નેનોભાયોટેકનોલોજીના ક્ષેત્રમાં નેનોમટીરીયલ્સની ઉપયોગીતા ચર્ચો. 7

અથવા

વિશિષ્ટ (ખાસ) આરકીટેક્ચર (બંધારણ) વાળા પોલીમર્સ (polymers)ની ધર-વપરાશના સાધનોના ક્ષેત્રમાં ઉપયોગીતા પર નોંધ લખો.

5. નીચેનાં પ્રશ્નોના ટૂંકમાં જવાબો આપો : 14

- (1) એક નેનોમીટર બરાબર કેટલા મીટર ?
- (2) ગોલ્ડ નેનોપાર્ટીક્લ્સનું ગલનબિંદુ બલ્ક ગોલ્ડ (bulk gold)ના ગલનબિંદુથી કેમ ઓછું છે ?
- (3) સોનોકેમીકલ સંશ્લેષણનો એક ઉપયોગ આપો.
- (4) વૂર્ટ્ઝાઈટ (Wurtzite) ZnSના નેનો પાર્ટીક્લ્સ કેવા પ્રકારનું બંધારણ ધરાવે છે ?
- (5) SWNTનું પુરું નામ લખો.
- (6) કવોન્ટમ વાયર્સ (quantum wires) શું છે ?
- (7) નેનો ફાયબર શું છે ?
- (8) STMનું પુરું નામ શું છે ?
- (9) વૈજ્ઞાનિક અર્નસ્ટ રસ્કા (Ernst Ruska)નો નેનોવિજ્ઞાનમાં શો ફાળો છે ?
- (10) વિજ્ઞાનની કઈ શાખામાં કોન્ફોકલ માઇક્રોસ્કોપનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે ?
- (11) ઓપ્ટિકલ માઇક્રોસ્કોપી (optical microscopy) અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી (electron microscopy) વચ્ચેનો એક તફાવત લખો.
- (12) ફોટો ઉદ્વીપક (Photocatalysts) તરીકે નેનોમટીરીયલ્સના ઉપયોગનું એક ઉદાહરણ આપો.
- (13) અવકાશયાનમાં વિવિધ ઉપયોગીતા માટે નેનોમટીરીયલ્સ કેમ વપરાય છે ? એક કારણ આપો.
- (14) સ્પીનટ્રોનીક્સ (spintronics) એટલે શું ?

Seat No. : _____

AG-135

April-2015

B.Sc., Sem.-VI (CBCS Sem. System)

**311 : Chemistry
(Nanomaterials and Nanotechnology)**

Time : 3 Hours]

[Max. Marks : 70

Instructions : (1) All questions carry equal marks.
(2) Figures to the right indicate marks.

1. (A) Write a short note on Sol-Gel Method with diagram. 7

OR

Write a note on Self-assembly of Nanoparticles using organic molecules.

- (B) What is Sputtering ? Discuss Sputter deposition method with diagram. 7

OR

Explain Laser Vaporization method with diagram and give one use of it.

2. (A) Explain the terms : 7

- (i) Quantum dots, and
(ii) Quantum wells

OR

Write a note on types of carbon nanotubes.

- (B) Write a note on Fullerenes. 7

OR

Explain the term ‘‘Nanorods’’ and write a note on metallic nanorods.

3. (A) Write a note on Transmission Electron Microscope with diagram. 7

OR

Write a note on Scanning Electron Microscope with diagram.

- (B) Discuss X-ray Diffraction technique for Nanomaterials with diagram. 7

OR

Explain Auger Electron spectroscopy with diagram.

4. (A) Write a note on applications of nanotechnology in the field of solar energy. 7

OR

Explain the applications of nanotechnology in electronics displays and other such devices.

- (B) Discuss the applications of nanomaterials in the fields of Nanomedicine and Nanobiotechnology. 7

OR

Write a note on applications of polymers with special architecture in the field of domestic appliances.

5. Answer the followings in brief : 14

- (1) One nano metre is equal to how many metres ?
 - (2) Why gold nano particles has less melting point than the melting point of bulk gold ?
 - (3) Give one use of Sonochemical synthesis.
 - (4) What type of structure Wurtzite ZnS nanoparticles possess ?
 - (5) Write the full form of SWNTs ?
 - (6) What are quantum wires ?
 - (7) What is Nano-fiber ?
 - (8) What is the full form of STM ?
 - (9) What is the contribution of scientist Ernst Ruska in Nano science ?
 - (10) Which branch of science involves wide use of confocal microscope ?
 - (11) Write one difference between optical microscopy and electron microscopy.
 - (12) Give one example of use of Nano materials as photocatalysts.
 - (13) Why nanomaterial is used for various applications in spacecrafts ? Give one reason.
 - (14) What is spintronics ?
-